



જાહેરાત ક્રમાંક નં ૧૧/૨૦૧૯-૨૦

ફાર્માસિસ્ટની ૧૧ માસના કરાર પદ્ધતિથી ભરતી કરવા બાબત

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ધી અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ માટે નીચે જણાવેલ સ્ટાફની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારે ભરવા તથા તેની પ્રતિક્ષાયાદી બનાવવા સદરહુ જાહેરાત આપવામાં આવેલ છે. માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેમના નામ, સરનામું, ઉમર, શૈક્ષણિક લાયકાત તથા અનુભવ અંગેની વિગત આ સાથે સામેલ ફોર્મટમાં સ્વઅક્ષરે ભરી અરજી પત્રક તથા જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે તા.૦૨/૧૦/૨૦૧૯ થી તા.૧૧/૧૦/૨૦૧૯ સુધીમાં સાંજના ૬:૦૦ વાગ્યા સુધીમાં શહેરી કુટુંબ કલ્યાણ એકમ, બીજો માળ, આરોગ્ય ભવન, જુનું ટી.બી હોસ્પિટલ કંપાઉન્ડ, જુના એસ.ટી.બસ સ્ટેન્ડની સામે, ગીતા મંદીર રોડ, આસ્ટોડિયા દરવાજા પાસે, જમાલપુર, અમદાવાદ - ૩૮૦૦૨૨ ખાતે રૂબરૂ અથવા રજીસ્ટર એ. ડી. મોકલવાની રહેશે.

ઉપરોક્ત પોસ્ટ માટેની જરૂરી લાયકાત, ઉમર અંગેની સ્પષ્ટતા ઉચ્ચ માસિક વેતન તથા અનુભવ અંગેની સ્પષ્ટતા દર્શાવતી વિગતો નીચે મુજબ છે.

ક્રમ	જગ્યાનું નામ	જરૂરી શૈક્ષણિક લાયકાત	અનુભવ	ઉંમર	ઉચ્ચ માસિક વેતન
૧	ફાર્માસિસ્ટ	૧. માન્ય યુનિવર્સિટીમાંથી ફાર્મસીની ડીગ્રી અથવા ડીપ્લોમા અને ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ. ૨. બેઝીક કોમ્પ્યુટર સર્ટિફિકેટ ધરાવનાર ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે.	સરકારી સંસ્થા / અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન / અર્બન હેલ્થ સોસાયટી, અમદાવાદમાં કામગીરીનો અનુભવ ધરવતા ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે.	મહત્તમ ૬૨ વર્ષ	રૂ.૧૩,૦૦૦/- ક્રિક્સ

શરતો

- અરજદારે અરજી ફોર્મ સાથે લાયકાત તથા અનુભવનાં તમામ પ્રમાણપત્રની પ્રમાણિત નકલ જોડવાની રહેશે. જો પ્રમાણપત્રની નકલ જોડેલ નહીં હોય તો તેવી અરજી રદ ગણવામાં આવશે તેમજ અરજી ફોર્મ ભર્યા બાદ અરજીમાં દર્શાવેલ વિગતોના તથા અરજી સાથે જોડેલ પ્રમાણપત્રના અસલ પુરાવા રજૂ નહીં કરે તો અરજીની ઓફીસેથી લીધેલ નિર્ણય છેલ્લો ગણાશે. તે અંગે ઉમેદવારનો કોઈ હક્ક દાવો રહેશે નહીં.
- અનુક્રમ નં. ૧ અને ૨ ના ઉમેદવાર પૈકી જેઓની ઉંમર ૫૮ થી ૬૨ વર્ષની વચ્ચે હોય તેઓએ સરકારી હોસ્પિટલમાંથી ફીઝીકલ ફીટનેસનું સર્ટીફિકેટ અરજી સાથે જોડવાનું રહેશે.
- આ જગ્યાની ભરતી પ્રકીયાનાં અનુસંધાને આ જાહેરાતમાં કોઈપણ કારણોસર તેમાં ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાનો ખાતાના ઉચ્ચ અધિકારીને સંપૂર્ણ હક્ક/અધિકાર રહેશે અને ઉચ્ચ અધિકારી આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહીં.
- સીલેક્ટ થયેલ ઉમેદવારની નિમાણુંક ૧૧ માસ માટે રહેશે. કોન્ટ્રાક્ટ પૂર્ણ થતાં જો કર્મચારીની કામગીરી સંતોષકારક હશે તો ૧ દિવસનો બ્રેક આપી તેનો કોન્ટ્રાક્ટ રીન્યુ કરવામાં આવશે.
- સીલેક્ટ થયેલ ઉમેદવારે ધી અર્બન હેલ્થ સોસાયટીના વખતોવખત નક્કી થતા ધારાધોરણો પ્રમાણે કામગીરી કરવાની રહેશે.
- પસંદ થયેલ ઉમેદવારોએ નિમાણુંક અગાઉ નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ધી અર્બન હેલ્થ સોસાયટી, અમદાવાદ સાથે કરાર કરવાનો રહેશે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે કોઈ હક્કદાવો રહેશે નહીં.
- ઉપરની જગ્યા માટે જે તે તબક્કે કોઈપણ પ્રકારનું રાજકીય કે સંસ્થાકીય દબાણ કરવામાં આવશે તો તેઓની નિમાણુંક રદ કરવામાં આવશે.



URBAN HEALTH SOCIETY

AHMEDABAD MUNICIPAL CORPORATION
"AAROGYA BHAVAN", Second Floor, Old TB Hospital Compound,
Opp Old Gita Mandir S.T. Bus Stand, Gita Mandir Road.- 380022 . Tel: 079-25392185



8. ઉમેદવારનાં માર્કસ ગ્રેડમાં હોય તેવા ઉમેદવારે જે યુનિર્વસીટીમાંથી ડીગ્રી મેળવી હોઈ તે યુનિર્વસીટીનું ગ્રેડને ટકાવારીમાં ફેરવવા અંગેનો પ્રમાણપત્ર રજૂ કરવાનો રહેશે.
9. સ્ટેટ હેલ્થ સોસાયટી દ્વારા વખતો વખત મળતી સુચના મુજબ પગાર ધોરણમાં સુધારા વધારા કરવામાં આવશે.
10. પસંદગી પામેલ ઉમેદવાર નિમણૂક અધિકારી ઠરાવે તે શરતોને આધીન નિમણૂક મેળવવાને પાત્ર થશે.
11. ઉમેદવારની મેરીટ યાદી ઉમેદવારની આવેલ અરજીઓ ઉપરથી તૈયાર કરવામાં આવેલ હોવાથી જો તેમાં કંઈ પણ ક્ષતિ અથવા ખોટું કરેલ હોય તેવું જણાશે તો જે ઉમેદવારનું મેરીટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે નહીં.
12. ઉમેદવારની નિમણૂક અંગે રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર દ્વારા સુધારો સુચવવામાં આવે તો તે મુજબ સક્ષમ સત્તધિકારીશ્રીની મંજૂરીથી તેમાં સુધારો કરવામાં આવશે.

મેમ્બર સેક્રેટરી

ધી અર્બન હેલ્થ સોસાયટી, અમદાવાદ